

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૭/૧૧/૨૦૧૫ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૨૨૬૫/૧૫

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૯ કેસ કરી ૫૬ વ્યક્તિઓને ઝડપી ૧૦૫ લીટર દેશી દારૂ, ૬૮૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૮૮ બિયર ટીન અને ૦૩ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૦૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૭૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યાં હતાં.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૬૬/૧૫

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૧૧ મુજબ કુલ ૧૭૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૦૪ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૨૨૬૭/૧૫

ચાંદખેડા : શ્રીનાથરાય બ્રીન્દારાય રાય (૨હે. રેલવે કોલોની, ખોખરાબ્રીજનાં છેડે, મણીનગર) એ તા.૬/૧૧/૧૫ નારોજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આરોપી રાજુસિંગ યાદવ (જેનાં પુરા નામ-સરનામાની ખબર નથી) તા.૧૦/૦૧/૧૫ નાં રોજ શ્રીનાથ રાય પાસેથી ૧૦ પૈડાવાળી ટ્રક નંબર જીજી.૦૧.૪૨૩૨ કિંમત રૂપિયા ૧૨,૦૦,૦૦૦/- માસીક રૂપિયા ૪૫,૦૦૦/- ના ભાડેથી મેળવી બાદમાં ભાડુ કે ટ્રક પરત નહીં કરી શ્રીનાથરાય સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.વાઢેર ચલાવે છે.

ઘરફોડ :-

સમાચાર યાદી નં.૨૨૬૮/૧૫

મણીનગર : પ્રિયંકભાઇ મુકેશભાઇ શાહ(૨હે. કૃપા એવન્યુ, રાધા વલ્લભ કોલોની, રાવજીભાઇ ટાવર પાસે, મણીનગર) એ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૬/૧૧/૧૫ સવારનાં ૧૧/૩૦ થી બપોરનાં ૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાની જાળીનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના તથા ડાયમંડનાં દાગીના તથા રોકડ રૂપિયા ૧,૦૭,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૭૧,૦૦૦/- મતાની ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એન.એસ.દેસાઇ ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૨૬૯/૧૫

સોલા હાઇકોર્ટ : રમેશભાઈ હરીભાઈ આહિર (ઉ.વ.૪૨)(રહે.ધનજીકાકા નગર સોસાયટી, શાયોના સીટી સામે, ચાણક્યપુરી) તા.૬/૧૧/૧૫ સવારનાં ૮/૦૦ વાગ્યાના સુમારે સોલા ભાગવતથી શટલ ઓટોરીક્ષામાં બેસી શાયોના સીટી સુધીની મુસાફરી દરમ્યાન રીક્ષા ચાલક અને તેમાં બેસેલ પેસેન્જરોએ રમેશભાઈનાં પર્સમાંથી નજર ચુકવી રૂપિયા ૬,૬૬,૦૦૦/- ની ચોરી કરી લઈ હતી. આ અંગેની ફરીયાદ રમેશભાઈ આહિરી સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.બી.સૈયદ ચલાવે છે.

એલીસબ્રીજ : રાકેશભાઈ ગણપતભાઈ મહેતા (ઉ.વ.૪૫)(રહે.લીએન એપાર્ટમેન્ટ, રાધાકૃષ્ણ મંદિર પાસે, નારણપુરા) એ તા.૬/૧૧/૧૫ નારોજ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૧૧/૧૫ સાંજનાં ૭/૧૫ વાગ્યાનાં સુમારે પાલડી સહજાનંદ કોમ્પલેક્ષની સામે, રાકેશભાઈની નજર ચુકવી અજાણ્યો ઇસમ (૨૨ થી ૨૫ વર્ષના આશરાનો) કારમાંથી લેપટોપ,મોબાઇલ અને કેમેરા મુકેલ બેગ કિંમત રૂપિયા ૫૩,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એસ.કંદોરીયા ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૨૨૭૦/૧૫

સાબરમતી: હંસાબહેન ચંદુભાઈ રાવળ (ઉ.વ.૫૦)(રહે.આલોક બંગ્લોઝ, ખોડીયાર માતાજી મંદિર રોડ, ન્યુ રાણીપ સાબરમતી) તા.૬/૧૧/૧૫ સવારના ૮/૧૫ વાગ્યાના સુમારે રહેણાંક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક હોન્ડા સાઇન મોટર સાયકલ નંબર જીજે.૦૧.એમ.ડી.૭૭૩૩ ઉપર આવેલ પુરૂષ (૩૫ થી ૪૦ વર્ષના આશરાનો) હંસાબહેનનાં ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ખેંચી મોટર સાયકલ ઉપર બેસવા જતી વખતે હંસાબહેને મોટર સાયકલ પકડી લેતાં, મોટર સાયકલ સ્થળ ઉપર મુકી અજાણ્યો પુરૂષ નાસી ગયો હતો. આ ગુનાની ફરીયાદ હંસાબહેન રાવળે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એમ.છાસીયા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૭૧/૧૫

રિવરફ્રન્ટ (ઇસ્ટ) : રાયમલભાઈ મુળજીભાઈ રબારી(ઉ.વ.૪૨)(રહે.કાંતી સોસાયટી,પ્રભાતચોક ઘાટલોડિયા) એ તા.૬/૧૧/૧૫ ના ૭/૨૦ વાગ્યા પહેલાં કોઇપણ સમયે પોતે બેકાર હોઇ, માનસિક સ્થિતિ સારી ન હોઇ, ગાંધીબ્રીજ ઉસ્માનપુરા રીવરફ્રન્ટ નજીક સાબરમતી નદીમાં પડી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રવિણભાઈ અળખાભાઈ ચલાવે છે.

રિવરફ્રન્ટ (વેસ્ટ) : રૂષિકભાઈ ગોવિંદભાઈ મિસ્ત્રી (ઉ.વ.૧૯)(રહે.રજનીગંધા ફ્લેટ, વિવેકાનંદ પાર્ટી પ્લોટ પાસે, વેજલપુર) એ કોઇ કારણસર તા.૬/૧૧/૧૫ સવારના ૮/૧૫ વાગ્યા પહેલાં કોઇપણ સમયે નહેરૂબ્રીજનાં સાબરમતી નદીનાં પૂર્વ છેડે સાબરમતી નદીમાં પડી આત્મહત્યા કરી હતી. આ અંગે રીવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી એ.બી.ગોહીલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.